

B.Ed. Semester - 2 (CBCS) Examination
April/May-2023 (NEW COURSE)
Accountancy Content(GROUP A CONTENT-1)

Time: 01:15 Hours

Marks: 35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન.૧ નીચેના પ્રત્યેક પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપો. (૦૫)
- (1.1) સિદ્ધાંતની ભૂલ એટલે શું?
 - (1.2) ઘસારાની વ્યાખ્યા આપો.
 - (1.3) જોગવાઈ એટલે શું?
 - (1.4) નાણાકીય પત્રકો એટલે શું?
 - (1.5) પૂજાનું પાનું એટલે શું?
- પ્રશ્ન.૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના ઉત્તર આપો. (૭ માંથી પાંચ) (૧૦)
- (2.1) ભરપાઈચૂક એટલે શું?
 - (2.2) ઘસારાના હેતુઓ જણાવો.
 - (2.3) અનામતના લક્ષણો જણાવો.
 - (2.4) નાણાકીય પત્રકોના હેતુઓ સ્પષ્ટ કરો.
 - (2.5) ઉપરટપકે એટલે શું?
 - (2.6) નામા માટે તૈયાર ઉપલબ્ધ સોફ્ટવેરના નામ આપો.
- પ્રશ્ન.૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો. (૭ માંથી પાંચ) (૨૦)
- (3.1) કાચા સરવૈયાને અસર કરતી ભૂલો સમજાવો.
 - (3.2) ઘસારાની ઘટતી જતી બાકીની પદ્ધતિ અને સરખા હપ્તાની પદ્ધતિ વચ્ચે તફાવતના ચાર મુદ્દા સ્પષ્ટ કરો.
 - (3.3) સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચે તફાવતના ચાર મુદ્દા સ્પષ્ટ કરો.
 - (3.4) પાકા સરવૈયાનો નમૂનો આપો.
 - (3.5) દેશી નામાપદ્ધતિના લક્ષણો સ્પષ્ટ કરો.
 - (3.6) કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગો સ્પષ્ટ કરો.

ENGLISH VERSION

Que.1 Answer each of the following in brief. (05)

- (1.1) What is error of principle?
- (1.2) Give definition of depreciation?
- (1.3) what is provision?
- (1.4) what is financial statements?
- (1.5) What is “page of pooja”?

Que.2 Answer any 5 from the following 6. (5 out of 6) (10)

- (2.1) What is compensatory errors?
- (2.2) List objectives of depreciation.
- (2.3) State the characteristics of reserves.
- (2.4) Mention objectives of financial statements.
- (2.5) What is “upartapake”?
- (2.6) Name readymade software for accounting.

Que.3 Answer any 5 from following 6 in detail. (5 out of 6) (20)

- (3.1) Explain errors that affect the trail balance.
- (3.2) Explain four point of difference between reducing balance method of depreciation and fixed installment method.
- (3.3) Explain four point of difference between general reserve and capital reserve.
- (3.4) Give specimen of balance sheet.
- (3.5) Explain characteristics of Deshi Nama System.
- (3.6) Explain components of computer accounting.
